

WLL/SEC/2024 January 01, 2024

To

BSE Limited
Department of Corporate Services,
SP. J. Towers, Dalal Street,
Mumbai – 400 001
(Scrip Code-514162)

National Stock Exchange of India Limited
Listing Compliance Department
Exchange Plaza, Bandra-Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051
(Symbol: WELSPUNLIV)

Dear Sirs/ Madam,

Sub: Disclosure under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

With reference to Postal ballot Notice submitted on December 29, 2023, please find enclosed herewith the copies of the advertisements published in the English Daily – 'Financial Express' and Gujarati translation thereof in 'Kutch Mitra' and 'Kutch Uday' on December 30, 2023 with respect to completion of dispatch of Postal Ballot Notice to the shareholders.

The newspaper publications are also available on the website of the Company at the following link:

https://www.welspunliving.com/uploads/investor_data/investorreport_8748.pdf

Please take note of the above.

For Welspun Living Limited (Formerly known as Welspun India Limited)

Shashikant Thorat Company Secretary ICSI Membership No.: FCS-6505

Encl: as above

Welspun Living Limited (Formerly known as Welspun India Limited)

Welspun House, 6th Floor, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (W), Mumbai 400013. India T: +91 22 6613 6000 / 2490 8000 | F: +91 22 2490 8020 E-mail: companysecretary_wil@welspun.com | Website: www.welspunliving.com

Registered Address: Welspun City, Village Versamedi, Taluka Anjar, District Kutch, Gujarat 370 110. India T: $+91\ 28\ 3666\ 1111\ |\ F: +91\ 28\ 3627\ 9010$

Works: Survey No. 76, Village Morai, Vapi, District Valsad, Gujarat 396 191. India T: +91 26 0243 7437 | F: +91 26 0224 37088

Corporate Identity Number: L17110GJ1985PLC033271

BRAZIL'S MILEI DECLINES INVITATION FROM MEMBER COUNTRIES

BRICS to grow as Saudi, Iran, **UAE and 2 others join ranks** that year. The group held its first leaders' summit in 2009 and invited South Africa to join

part of January 30 sherpa meeting

ANA MONTEIRO December 29

MEMBERSHIP OF THE BRICS group of emerging-market nations is set to double, with Saudi Arabia, Iran, the United Arab Emirates, Ethiopia and Egypt to join its ranks on January 1, South Africa's envoy

January I, South Africa's envoy to the blos caid.

Current members Brazil, Russia, India, Chima and South Africa in August invited six other nations to become part of their group, pairing some of the planer's largest energy producers with some of the developing countries. Only Argentina declined the invitation after President Jaive tion after President Javier Milei, who took office this



month, reversed his predeces-sor's membership bid.

The five invitees sent senior-level representatives to a BRICS sherpa meeting in Durban, South Africa, earlier this month and they fully par-ticipated in the gathering, "a clear indication that they have accepted the invitation" to join, Anil Sooklal, Pretoria's ambas-sador to the bloc, said in an interview Friday. The new members will also send offimembers will also sell diffi-cials to a sherpa meeting in Moscow on Jan. 30, he said. "BRIC" was coined in 2001 by economist Jim O'Neill, then

The term was intended as an optimistic scenario for optimistic scenario for investors amid market pessimism following the terrorist attacks in the US on Sept. 11 About 30 countries want to establish ties with the bloc, Russian Foreign Affairs Minister Sergey Lavrow was cited by news agency Tass as saying this week. Nigeria, Africa's most populous nation, will seek to become a member of BRICS within the next two years, Minister of Foreign Affairs Yusuf Tuggar Said in November.

Except for India, the BRICS have underperformed their

a year later, adding another continent and the letter "S."

About 30 countries want to

Except for India, the BRICS have underperformed their emerging-market peers over the last five years, according to Bloomberg Intelligence. Ussled sanctions have put Russla off limits for many foreign investors, and some sectors in China – especially technology companies – have also been sanctioned or face potential investment bans. investment bans.

— BLOOMBERG

FROM THE FRONT PAGE

Bulls may stay in the ring

WITH THE INTERNATIONAL Monetary Fund terming India as 'one of the star performers' which will contribute more than 1604 to global growth, the interest in the Indian economy will only rise.

Sharma points out structurally, India is one of the few countries with sound macros and corporate earnings, while most developed nations continue to be weighed down by weak macros. 'And when there are exexpectations that there will be a bull market in the US, we should also do well,' he says.

Of course, there could be some key events that could cloud this optimistic outlook. Naren, for example, says apart from the general election in India, markets will be watching ke mercet in the government of the US was a sealing signals of continuity and stability after the good performance of the Bhartiya lanta Party in the recent state.



Sharma says while elections are a key event, people would be watching keenly whether the government continues to spend aggressively after elec-tions as well

while the overall outlook towards 2024 looks quite bright, some fund managers point at the "worrisome" rise in point at the "worrisome" rise in the retail participation in the future and options market. In the past three consecutive

vears, F&O turnover has risen years, F&O turnover has risen by over 100% – the highest was in 2021 at 186% – reflecting that there has been aggressive participation from retail investors. This is also reflected in the rise in the number of online courses and finfluencers who are trying to make a quick buck by exploiting investors. However, most of them also believe that there is m also believe that there is little to be done as the markets

Parsynaths

PARSVNATH DEVELOPERS LIMITED Regd. & Corporate Office: Parsvnath Tower, Near Shahdara Metro Station, Shahdara, Delhi - 110 032 CIN : L45201DL1990PLC040945; Tel. : 011-43050100, 43010500; Fax : 011-43050473

		Standwone				Consolidated			
S. No	Particulars	Quarte	ended	Half year ended Year ended		Quarter ended		Half year ended	Year ended
٠		30292023	30,09,2022	30009-2023	31.03-2023	30,09,2023	30,09,2022	3040942023	31-03-2023
		Unaudited	Unaudited		Audited	Unaudited			Audited
1	Total income from operations	6,913-76	2/150-09	9,975-14	31,559-10	11:767-07	4,476-47	17,529-22	47,070.97
	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordicary forms)	(905,24)	(4,270,44)	16,405-12	-(26,647.90)	(7,539,39)	(9,926-75)	(20,675.68)	(50,78740)
3	Net Profit / (Loss) for the period before Tex (after Exceptional and / or Extraordinary forms)	(902v21)	(4,275/44)	(0,400)12	(36,70477)	(7,400)(71)	(9,901470)	(23,540)30)	(60,22347
•	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Except hary Bons)	(905-21)	(0,275/00)	(9,003-78)	(45,190-77)	(7,48541)	(9,940,99)	(27,033.96)	(80,129-30
	Total Comprehensive Income for the period (Comprising Peolic) (Loss) for the period (after tax) and other Comprehensive (Income (after tax))	(888/80)	(4,283,41)	19,004.95	(45,200,10	(7,409299)	(9,944,92)	(27,055,13)	(80,137,71
0	Courty Share Caytel	20,759,06	21:759,05	21,759,06	21,759,00	21,759,00	21;759,06	21,759,00	21:759,05
7	Reserves (excluding revolutions reserve) as shown in the suction before sheet of the previous year)				35,376,07		-		[1,32,04276
0	Comings for Share (of Rs. 5/- each) for continuing and clacentinued operations								
	- Basic (in Repeat)	(0.21)	(6499)	19:07	(10/36)	(1/71)	(2/29)	(6/20)	119-39
	- District (in Australia	19,811	10,585	18,07	110,581	0.71	12,19	16,20	110,00

- unaudited results for the quarter and half year ended 30 september, 2025.

 In above is an extract of the detailed format of the standardions and consolidated financial Results half year ended 30 September, 2023, filed with the Stock Eachanges under Regulation 33 of the SEBI and Disclourse Regulation 32 of the SEBI and disclourse regulation and consolidated for the quarter and half year ended 30 September, 2023 are available on the Stock Exchanges websites (year downwise) and work beneficial control and work beneficial control and work beneficial control and work beneficial work of the SEBI and SEB

For and on behalf of the Board Sd/-Pradeep Kumar Jain Chairman DIN: 00333486

Date of incorporation of Corporate Debtor 29/03/201
Authority under which Corporate Debtor ROC Hwi

Insolvency Commencement Date in respect of the Corporate Debtor
Estimated date of closure of Insolvency Resolution Process

lasses of creditors, if any, under clause (b) sub-section (8A) of section 21, ascertains the Interim Resolution Professionals identified and of Authorized Representative of Creditor and as Authorized Representative of Creditor and ass (Three names for each class) I Relevant Forms and

s incorporated/registered corporate Identity Number of Corporate U45209TG2011PLC073568

Welspun LIVING WELSPUN LIVING LIMITED

| Fig. 1 | Fig. 2 | F

POSTAL BALLOT NOTICE

incline in the property and the process of the property of the

ne Ministry of Corporate Affairs ce at 9.00 a.m. on Saturdav. De

E-Voting will end at 5.00 p.m. on Sunday, January 28, 2024 and e-Voting will not

Le Fouling will martine at styll. 3m. no Saturdey, December 30, 2023.

S. E-Velling will ent 18, 500 pm. no Sandry, January 28, 2024 and e-Velding will not be allowed beyond the said date and time;

A. Se per Gerneral Chocas the Company is providing to the Members the facility to exercise their right to vale by electronic means through e-velling services provided by NSDL and the business may be transacted through such e-velling services provided dispatching Posal Ballot Form.

The procedure of e-Velding is given in the Notes to the Notice of Postal Ballot, In case of any query regarding e-Velding you may also refer the Frequently Asked Cuestions (PAGA) for Sharefalbes and e-velling manual available at https://www.vooling.nad.com.or write an ernal to evoting@inst.com.or act 1022 –4869 7000 and 022 –3499 7000.

In case d'any greening connected with the faulty for verbay pick-certionic means may be addressed to evoting@inst.com. (NSDL) National Securities Depository. Imited, A Mingra, 4ff Floor, Tarel Joseph College and the velocities of the Company of the Velocities of the Company of the Velocities of NSDL Institute (Velocities of NSDL Institute) and on National Slock Eurlangs of Postal Lamide velocities on https://www.beerlod.gom/ and on National Slock Eurlangs of Postal Lamide velocities on https://www.beerlod.gom/ and on National Slock Eurlangs of Post Lamide velocities on the property to Mingray Sceneraline, as Governations or conduction the register of the properties of Mingray Sceneraline, as Governations or conduction the register of the properties of Mingray Sceneraline, as Governations or conduction the register of the properties of Mingray Sceneraline, as Governations or conduction the register of the properties of Mingray Sceneraline, as Governations or conduction the register of the properties of Mingray Sceneraline, as Governations or conduction the register of the properties of Mingray Sceneraline, as Governations or conduction the register of the properties of Mingray Sceneraline, as Governations o

Exhange of Infall Limited website on Intps://www.sesindia.com/.
The Board Officerice of Infa. Company Secretaries, as Scrindizer for Oxfox, Proprietor of Miss, SPE & Associates, Practicing Company Secretaries, as Scrindizer for conducting the interest Seal Stall possess in a fair and response minamen.

The result of the Possil Balliot will be declared on Norther, January 29, 2004 at the Coporal Office of the Company by the Clamma and in the Sheep stall possess in a fair and response in the Sheep stall possess of the Company or by the Company Secretary and will allow be possed on the Company Secretary and will allow be possed on the Company Secretary and will allow the possess of the Company served in the Coporal Secretary and the Coporal Secretary and the Coporal Secretary and the Coporal Secretary and Secretary and Secretary and Secretary Secretary and the Coporal Secretary Secretary and the Coporal Secretary Se

financialexp.ep.o.in

customs unearth money laundering case, says finmin currency out of India. Investigations revealed that cheap synthetic diamonds were being misdeclared as natural diamonds PRESS TRUST OF INDIA New Delhi, December 2

THE INDIAN AND Hong Kong Customs have unearthed a major case of Trade-Based

THE INDIAN AND Hong Kong monds were being mischands and a major case of Trade-Based Money Laundering (TBML) involving Hong Kong-based exporters and Indian importers located in a Special Economic Zone (SEZ), the finance ministry said on Friday. In an exemplary case of bilater and exchange of information, this crack-down show-cases investigation, at the said money was represented and exchange of information, this crack-down show-cases investigation, at the finance ministry said on Friday. In an exemplary case of the finance ministry said on Friday. In an exemplary case of the finance ministry said on Friday. In an exemplary case of the finance ministry said on Friday. In a said monds were being mischeolared and evaluation and exchange of information, this crack-down show-cases investigation, at the finance was problem of the finance ministry said on Friday. In the finance of the finance ministry said on Friday. In the finance ministry said on Friday. In

DRI had unearthed a case of Trade-Based Money Laundering from a SEZ, wherein cheap synthetic diamonds were being imported into India in the guise of natural diamonds, to remit foreign

KERALA WATER AUTHORITY e-Tender Notice

this single bank account to overseas suppliers in Hong Kong; under the pretext of payment towards import of 'diamonds'.

The gathered evidence also indicates that the mastermind of this trade-based manual band dariance based. money laundering was based in Hong Kong, it added.

₹25 crore in damages from Dalal

INTHESIGNED acceptance of the employment offer from Cognizant, which has been flied with the USSEC, Dalahas said, 'Thereby represent and warrant to Cognizant that (f) I am entering into this agreement voluntarily and that the performance of my duties and responsibilities hereunder will not violate any agreement between me and any other person, firm, organisation, or other entity.' The letter adds, "(II) I am not bound by the terms of any agreement with any previous employer or other parties to refrain from competing, directly or indirectly, with the business of such previous employer or other party, in any case, that would be violated by my entering into this agreement and/or providing services to Cognizant pursuant to the terms hereof, and (III) I have read, understand and accept the above offer of employment and agree to the terms and conditions set forth above.' In the case flied by Wipro, Dalah has submitted an application seeking that the court to refer the matter for Wipro, Dalal has submitted an application seeking that the court to refer the matter for arbitration. Both parties have presented their arguments, and the next hearing has been scheduled for January 3.

Dalal worked with Wipro for over 21 years and served as its CFO since 2015.

Indian, Hong Kong Wipro seeks Govt cracks down on offshore gaming apps

THE BLOCKING OF the overseas gaming websites and platforms in India is in line with this stance. According to the government, while responsibility of paying tax can be passed to online gaming companies located abroad, if they also fail to do so, then, it would amount to transgressing the law. The regulation of foreign platforms will be undertaken through the ministry of electronics and information technology (MeitY).

On December 5, minister of state for finance Pankaj Chaudhary had said that no overseas online gaming company had registered in yladison mentioned that till October, 7.1 show cause notices involving GST to the tune of \$1.1 ztrillion have been issued to online gaming companies during FY22 and FY24 (April-October).

Experts say that measures like blocking of websites/apps are being used by the government to compel the offshore entities to comply with domestic laws. THE BLOCKING OF the over

"The effectiveness of this approach might be contingent on cooperation from platform owners who host these online gaming applications. The government should aim to make these platform owners aware of default and prevent access to depose the companies that do not complywith GSTIaws," said Ankur Gunta nractice leader— Ankur Gupta, practice leader -indirect tax at SW India.

indirect tax at SW India.
Sandeep Selgal, partner—
Tax, AKM Global, however notes that some offshore companies may be working on a B2B model, but the GST department could be of the view that the complaince is applicable on those offshore companies as well Under the companies as wel companies as well. Under the B2B model, GST is paid

Demand for luxury housing cements realtors' hope

VISWA PRATHAP DESU, chief operating officer - residential, Brigade Enterprises, said, "we anticipate luxury residential sales to be the focal point in 2024, with a growing demand for larger homes in expansive integrated enclaves. Our upcoming launches will primarily align with this trend." While Brigade will continue to have launches in Bangalore, it is also planning luxury offerings in Chennal and Hyderings in Chennal and Hyderabad, he said. 'Additionally, we are dedicated to enhancing the VISWA PRATHAP DESU, chief

sustainability quotient in our projects, recognizing its increasing significance in the years to come," Desu said. Swaroop Anish, executive director – business develop-

ment, Prestige Estates Project said they expect prices to strengthen 5-7 % for under strengthen 5-7 % for under construction options and ready property even 10-12% as there are shortage of quality options. Anish said theywould be enhancing their sales num-bers with the numerous launches planned.

U. P. Power Corporation Ltd.

R-APDRP Part-A (IT) Unit, Shakti Bhawan Ext., Lucknow Email: uppclccatender@gmail.com

Notice inviting Tender Date: 30-12-2023 e-Bids are invited from interested bidder against E-tender No. 11/UPPCL/ RAPDRPA/ CCA/2023 Dated 30.12.2023 for Selection of Customer Care Agency (CCA) for Establishment & Operation of UPPCL Customer Care Centre of five Discoms (PuVVNL, MVVNL, DVVNL, PVVNL and KESCO). Tender can be downloaded from UP e-tender portal https://etender.up.nic.in for further details. Any changes, corrigendum etc. shall also be notified on the website. UPPCL reserves the right to reject any or all proposals or cancel the bid without assigning any reason

Pre-bid meeting: At Shakti Bhawan, Lucknow on date 08.01.2024, time 12:00 hours onwards.

For D S Kulkami Developers Limited Surnit Ramesh Director Director 🕸 Karnataka Bank Ltd. 👀

The Annual Report is available on the website of the Company www.dskcirp.com and available on the website of stock exchange www.nseindia.com and www.bseindia.com.

Rembers can attend the meeting only in person and shall be counted for the purpose of Quor inder section 103 of the Companies Act. 2013.

D S Kulkarni Developers Limited CIR 14520PH1991PL083240 Regd. Off.: Unit No. 301, 3rd Floor, Svajas One, Kofnrad, Pune 411038 Pn. No: 220 6716 6716 Website: www.dskicip.com Email id: cs.dskid@aldhaproporeries in Notice of 32nd Adjourned Annual General Meeting

with all supporting documents is received by the Bank at its registered office within 15 days from the date of publication of this notice. No claim will be entertained by the Bank with respect to the original share certificate(s) subsequent to the issue of the duplicate thereof.

SI.	Folio No.	From T	o. To	From	No. To	No. of Shares	Name of the Share Holde
1	47146	448086		8019601	8021400	9886	DAREPPA UPPAR
	COURT	448086		15603345	15605144		
		448086		135053865	135065294		
		448086		190070907	190074854		
		463195		310706165	310707062		
2	47011	448085		8022551	8023250	2745	DAREPPA UPPAR
	1000000	448085		15606295	15606994		
		448085		190068583	190069678		
		463194		310705916	310706164		
3	31000079	448088		763001	764512	6177	DHAREPPA UPPAR
	ELECTRICAL STREET	448088		1811845	1814344		
		448088		135055295	135056898		
		463259		310710363	310710923		

tegd. & Head Office: P. B. No.599, Mahaveera Circle, Kankanady, Mangaluru - 575 002

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE

Notice is hereby given that the following share certificate(s) have beer reported as lost/ misplaced and upon request from the shareholder(s)/legal heir(s) the Bank will proceed to issue duplicate share certificate(s) to the below mentioned person(s) unless a valid objectio

SI. No	Folio No.	Cert No. From To		Dist From	No. To	No. of Shares	Name of the Share Holder	
1	47146	448086		8019601	8021400	9886	DAREPPA UPPAR	
	COURT	448086		15603345	15605144			
		448086		135053865	135065294			
		448086		190070907	190074854			
		463195		310706165	310707062			
2	47011	448085		8022551	8023250	2745	DAREPPA UPPAR	
	1000000	448085		15606295	15606994			
		448085		190068583	190069678			
		463194		310705916	310706164			
3	31000079	448088		763001	764512	6177	DHAREPPA UPPAR	
	ELECTRICAL STREET	448088		1811845	1814344			
		448088		135055295	135056898			
		463259		310710363	310710923			

ભચાઉમાં સરકારી જમીન પર

કરી છે.



જહાજ હુમલા સંદર્ભે ડી .જી . શિપિંગ દ્વારા માર્ગદર્શિકા જારી

ગાંધીધામ, તા. ૨૯ : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતાં યુધ્ધની દુરોગામી અસરનાં ચિંતાનાં વાદળો અસરના ાયતાના વાદળા ભારતના શિપિંગ ઉદ્યોગ ઉપર પણ મંડરાઈ રહ્યા છે. હમાસ દ્વારા રાતા સમુદ્ર સહિતના વિસ્તારોમાં જહાજો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ડાયરેક્ટ્રર જનરલ શિપિંગ

વચ્ચે ડાયરેક્ટર જનરલ સિપિંગ હારા ભારતીય જહાજો માટે વિવિધ તકેહારી રાખવાની સુવના દર્શાવતી માર્ગદર્શિક જારી કરવામાં આવી છે. ગાંધીધામના સિપિંગ લેગ જાંધા સુધી કંડભાયેલા , સુગોના જથા સુધી ઈઝ્સ્યલ હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી મહાક્ય જહાજો ઉપર હુમલા કરાશે તેવી ગીમકી સ્પાઈ હતી. તાજેત્રસ્માં ભારતીય જહાજી ઉપર નુભલ કરાશે તેવી ભારતીય જહાજ ઉપર પણ હુમલો કરાયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે જાણીતી કન્ટેનર લાઈનો દ્વારા રૂટ જ બદલી દેવાયો

ગાંધીધામ, તા. ૨૯ : ચક્રચારી મુદરા સોપારી : તોડકાંડના આરોપી પોલીસ બ્રિમાન પોલીકો રિમાન્ડ મેળવ્યા છે. તોડના પૈસામાંથી વાહનો અને જમીન ખરીદી હોવાની વિગતો બહાર આવી છે. તપાસનીસ અધિકારી

તપાસનીસ અધિકારી થરાદના નાયબ પોલીસવડા એસ.એમ. વારોતરિયાના

સ્વારા-પાંચન પાંતાસન્ય એસ.એમ. વારોતરિયાના જણાવ્યા પ્રમાણે આરોપી પાંલીસ કમી કિરીટસિંહ ઝાલાએ ભચાઉ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. તેના ગળપાદર જિલ્લા જેલમાંથી કબજો લઈ ભુજ એસીબી કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે આરોપીના ૧૪ દિવસના દિમાં ત્યા કરી હતી આખા

રિમાંડની માંગ કરી હતી. આખા

કારસામાં માસ્ટર માઈન્ડ કિરી-

ટસિંહે ૨૪ કલાકની કસ્ટડી

ગાયાયાન, તા. ૨૯ : સરહદી એવા કચ્છ જિલ્લામાં પોલીસે દારૂ અંગેની પાંચ જુદી જુદી કાર્યવાહી કરીને કુલ રૂા.

૧,૪૩,૮૫૫નો દારૂ હસ્તગત કર્યો હતો. આ ક્રમગીરી દરમ્યાન ચાર્ આરોપી પક્ડાયા હતા,

ચાર આરોપી પકડાયા હતા, જ્યારે ચાર શખ્સો પોલીસના

સાણસામાં આવ્યા નહાતા. ગાંધીધામમાં રા. ૫૯ હજારનો દારૂ જત શહેરના જૂની સુંદરપુરી ધોબીધાટ વિસ્તારના શિવ મંદિરવાળી શેરીમાં ગત મોડીરાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી.

પ્રવીણ સોલંકીના ઘરમાં પોલીસે

પ્રવાશ સાલકાના ઘરમાં પાલાસ છાપો મારી અહીંથી રોયલ સ્ટેગ, મેક્રપ્રેવેલ્સ નંબર-૧, ઓલ્ડ મોંક વગેરે બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની ૧૧૨, ૩૭૫ મિ.લિ.ની ૩૧ અને ૧૮૦ એમ.એલ.ના ૧૦૯ કવાર્ટરિયા

એમ કુલ્લ રૂા. ૫૯,૦૨૫નો શરાબ હસ્તગત કર્યો હતો. આ

દરોડા દરમ્યાન પ્રવીણ ભીમરાવ સોલંકીની ધરપકડ કરાઇ હતી,

જ્યારે પ્રથમ ખીમા મહેશ્વરી નામનો શખ્સ હાથમાં આવ્યો ન

... મનફરામાં અડધા લાખનો

સાણસામાં આવ્યા નહોતા.

સોપારી તોડકાંડનો મુખ્ય સૂત્રધાર

१४ हिवसना रिमान्ड तंणे

હોવાનું પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દરમ્યાન ડાયરેકટર જનરલ શિપિંગ દ્વારા જહાજના માલિકો, શિપ મેનેજર,

રાતા સમુદ્ર, ગલ્ફ ઓફ એડન, સોમાલી બેસિન, પર્સિયન ગલ્ફ, સ્ટ્રેટ ઓફ હોરમૂઝ સહિતનાં સ્થળે તકેદારી રાખવા સૂચના

શિપિંગ એજેન્ટ, શિપ માસ્ટર્સને આ નોટિસ આપવામાં આવી છે. રાતા સમુદ્ર, ગલ્ફ ઓફ એડન, સોમાલી બેસિન, પર્સિયન ગલ્ફ, સ્ટ્રેટ ઓફ હોરમૂઝ, અરબીયન સી સહિતના દરીયાઈ અરુપાવન સા સાહતના દરાવાઇ વિસ્તારમાં તકેદારી રાખવા અંગેની માર્ગદર્શિકા જારી કરાઈ છે. જહાજોમાં ની.એગ.એક. કોમ્યુનીકેશન સુદ્રઢ રાખવા, દરીયામાં રહેલા યુ.કે. ઈનીયા સહીતના યુધ્ધ જહાજા સાથે સંપર્ક રાખવો, ડ્રોન હુમલા સમયે

દરમ્યાન ખાસ કોઈ સહકાર આપ્યો ન હતો. ગુનાના બનાવમાં ઉપયોગમાં લેવાયેલી

બનાવમાં ઉપયોગમાં લેવાયેલી બન્ન કાર કોની માલિકીની છે. કારના માલિક અને ક્રિટિસિંહના શું સંબંધ છે? જો કાર તેની હોય તો હાલ લાંચાન્ય પૈસાથી ખરીદી છે કે કેમ, તે સહિતના મુદાઓની તપાસ જરૂરી હોવાનું પોલીસે કશું હતું. આરોપીએ ગુના સમય ઉપયોગમાં લીધેલો મોળાઈલ કોન સ્ટ્રજબારીની ખાડીમાં કેસે દીધો હોવાનું કહ્યું હતું. લાંચની ૨કમમાંથી ક્રિટીટસિંહન ૩.૦૨ ક્રયોની જો 3.02 કરોની જો 3.02

કરોડની જંગી રકમ મળી હતી. આ કરાડના જેગા રકમ મળા હતા. આ લાંચની જંગી રકમ કઈ જગ્યાએ મૂકી છે, અન્ય ફરાર પોલીસ કર્મચારીઓ સાથે શું વ્યવહાર કર્યા છે, તે બાબતે તપાસ કરવી જરૂરી

હોવાનું પોલીસે કહ્યું હતું. બનાવ

પડતર જમીનમાં દાટેલો શરાબ

પોલીસે શોધી કાઢ્યો હતો. મનકરાના ભવાન ખીમા કોળી

ગાંધીધામ, મનફરા, આડેસર,

ભુજ, કિડાણામાં કાર્યવાહી :

અને ગોપાલ ખીમા કોળી નામના

શખ્સોએ અહીં ખાડો ખોદી દારૂ રાખ્યાન અહા બાડા બાદા દાટુ સંતાડી રાખ્યો હતો, જે અંગે પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. અહીંથી મેકહેવેલ્સ નંબર-૧ની ૩૭૫ એમ.એલ.ની ૧૫૦ બોટલ કિંમત

અને અલે નાં ૧૫૦ ખાટલાકનત રૂા. ૫૬,૨૫૦નો દારૂ હસ્તગત કર્યો હતો, પરંતુ આ બે શખ્સો અહીંથી હાજર મળ્યા નહોતા.

આડેસરમાં શરાબ સાથે બે ઝડપાયા આડેસર રેલવે મથકથી ગામ

આડેસર રલવ મથકથા પામ વચ્ચે પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી બાઇક નંબર જી.જે.-૨૪-એ.આર.-પકલ્ટ આવતાં પોલીસે તેને રોકી બે શખ્સો પાસે રહેલા

ોલાની તલાશી લેતાં તેમાંથી દારૂ

૪ ઝડપાયા, ૪ ફરાર

ત્વરિત સાયરન વગાડવા, હેલીકોપ્ટરથી જહાજમાં થતી ઘૂસણખોરી ઉપર સતત વોચ રાખવી, ઉપરોક્ત વિસ્તારમાં રોખવી, ઉપરોક્ત વિસ્તારમાં કૃયારે પ્રવેશશો અને ક્યારે નીકળશો તે સહિતની તમામ વિગતો સાથેનું હોર્મ હીજી. શિપિંગને મોકલવા સહિતની સુવનાઓ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હુમલાના બનાવ પહેલાંની સામાન્ય સ્થિતિમાં ઉપરોક્ત દરીયાઈ માર્ગેથી કંડલા અને મુંદરા બંદર ઉપર આવતાં સંક્ર્ય જ્લાઇ પસાર થતાં હતાં, જેમાં ટેન્કર, ક્ન્ટેનર, ક્રાર્ગ સહિતના જહાજોનો સમાવેશ થાય છે. હવે આ પરિસ્થિતિના કારણે સુએઝ કેનાલમાં જેવું હોય તો પણ આ પોરીશ્રીતના કારણ સુઝઝ કેનાલમાં જવું હોય તો પણ મુશ્કેલીભયું હોવાનું શિપિંગ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલી તો કંડલા અને મુંદરાના ટ્રેડને નકારાત્મક અસર થવાની દહેશત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

કિરીટસિંહે બનાવ બાદ શિણાયમાં જમીન અને મોંઘી કાર ખરીદી : ૨૪ કલાકની કસ્ટડીમાં મગનું નામ મરી ન પાડ્યું

બાદ આરોપીએ ૧૭ લાખની મહિન્દ્રા થાર કંપનીની જીપ કાર ખરીદી છે. આ ઉપરાંત શિશાયમાં ૧.૦૦ કરોડના ખર્ચ જમીન પણ ખરીદી છે. બનાવ બાદ કઈ કઈ જગ્યાએ આસરો લીધો છે, તે સહિતની ચોક્કસ માહિતી મળી નથી આરોપીઓ જાવીરસિંહ ઝાલા અને ભરત અશારીયિયાભાઈ ગઢલી આશારિયાભાઈ ગઢવી

આશારિયાભાઈ ગઢવી અરસપરસના સંપર્કમાં હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. દલીલોના અંતે ન્યાયાયીશ દારા પોલીસની માંગ મુજબના ૧૪ દિવસના જ રિમાંડ મંજૂર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ કે.સી. ગોસ્વામીએ હાજર રહી દલીલો

આવી હતી.

અવા હતા. ભુજમાં શરાબ સાથે એક પકડાયો ભુજના શ્રીજીનગર-અરિહંત નગરમાં મકાન ભાડે રાખી દારૂ વેચતા કિરીટ ગોપાળસિંઘ

વેચતા કિરીટ ગોપાળસિંઘ મરદારના કબજાના મકાનમાં પોલીસે છાપો માર્યા હતો. આ મકાનમાંથી સિગ્રામ, ધ ફેમસ, વ્લેક એન્ડ વ્હાઇટ, ટીચર્સ, મેજિક મોમેન્ટ બ્રાન્ડની ૧૨ બોર્ડ્સ કોમત રૂ. ૧૧,૨૮૦નો અંગ્રેજી શરાબ જન્મ કરી શખ્યની ઘરપકડ કરવામાં આવી હતી

કરવામાં આવી હતી. કિડાણામાં દારૂ જપ્ત : આરોપી હાથ ન આવ્યો

આરોપા કાર્ય ન આવા ગાંધીયામ તાલુકાના ક્રિડાણાના કરણીનગર મકાન નંબર ૧૪૩માં પોલીસે છાપો માર્યો હતો. આ મકાનમાંથી રોયલ સ્ટેગની ૧૦ બોટલ કિંમત્

રાયલ સ્ટગના ૧૦ ભાટલ કમત રૂા. ૫૨૦૦નો દારૂ જપ્ત કરાયો હતો પરંતુ આરોપી કાનજી અમારા ભરવાડ પોલસીના સાશસામાં આવ્યો ન હતો. તમામ દરોડાઓમાં પકડાયેલો

કરવામાં આવેલા સંજાના જાગવ-ાઈનો વિરોધ કરવા પાટે ડાઈવ-એકતા શુપ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જો ચાલક અકસ્માત સર્જી વાહન મુકીને નાસી જાય તો ૧૦ વર્ષની કંદની સજા અને પાંચ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગલાઈ કરવામાં આવી છે. આ જોગવાઈના વિરોધમાં સા-મખિયાળી આર.ટી.ઓ. ચેક્યોસ્ટ ખાતે ચક્કાજામ કરવામાં આવશે. જિલ્લામા પાચ સ્થળે ૧.૪૩ લાખનો શરાબ જપ્ત જાત વડકાજાન કરવાના આવત. મામાન્ય પગારધાં રકામ ડ્રાઈવરોનું કામ જોખમી હોય છે, ત્યારે આ પ્રકારના નિર્ણય સામે વિરોધનો સુર બળુઠો બની રહ્યો છે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાઈવે હોટેલો ઉપર ભારે વાહનોની સંખ્યા સાજથી જ વધી રહી છે પાસેથી વાઇટલેસ વોડકા ૧૮૦ એમ.એલ.ના ૧૨૧ કવાર્ટરિયા કિંમત રૂા. ૧૨,૧૦૦નો દારૂ જપ્ત કરીને બંનેની અટક કરવામાં

દેવીસરમાં જાહેરમાં જુગાર ખેલતા ત્રણ ખેલી ઝડપાયા

ગાંધીયામ, તા. ૨૯ : -- ખત્રાણા તા. લુકાના દેવીસર ગામે જાહેરમાં જુગાર રસતા ત્રણ ખેલીઓને પક્ષેત્ર પાત્રી પાલી પોલીસે રોકડ શ. ૩૫૩૦ જન્મ કર્યા હતા. દેવીસર ગામે પળમાના મંદિરતી આગળ આવેલ નદીમાં બાવળની ઝાડીમાં અમુક શખ્યો પાણીપાસા વર્ષે પાંતાનું નસીભ જજમાવી રહ્યા હતા તેવામાં આજે બપારે જ્વાનક પોલીસ અજમાવા રક્ષા હતા તવામા આજે બપોરે અચાનક પોલીસ ત્રાટકી હતી અને નવાનગરના હાસમ ઉર્કે અપન મામદ હિંગોરજા, નાની અરલના દમજાન અલી જુણેજા તથા દેવીસરના કાનજી ગોવા પાયણાને પઠઠી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. ૩૫૩૦ તથા ધાણીપાસા નગ બે હસ્તગત

પાવર બંધ રહેવાની નોટિસ

આથી અમારા માનવંતા વીજગ્રાહકોને જણાવવાનું છે, નીચે મુજબના વીજ ફીડરનું સમારકામ કરવાનું હોવાથી તથા આ વીજ ફીડરને કોસિંગ થતા ફીડરો નીચેની તારીખના રોજ ફીડરમાં વીજપુરવઠો ૦૭.૦૦થી ૧૬ . ૦૦ વાગ્યા મધી લંધ રહેશે.

ક્રમતં.	તારીખ	એસ.એસ.નું નામ	ફીડરનું નામ		
٩		મુન્દ્રા એસ.એસ.	૧૧ કેવી મુન્દ્રા ટાઉન અર્બન		
5	30-45-5053	પત્રી એસ.એસ. ૧૧ કેવી ખુશી જેજીવા			

પી.જી.વી.સી.એલ. માંકવી ડીઓ

PGMCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGMCL પાવર બંધ રહેવાની નોટિસ

આથી અમારા માનવંતા વીજગાહકોને જણાવવાનું કે, નીચે મુજબના વીજ ફીક્રસ્નું સમારકામ કરવાનું હોવાથી તથા આ વીજ ફીક્રસ્ને કોસિંગ થતા ફીક્સે નીચેની તારીખના રોજ ફીક્સમાં વીજપુરવઠો ૦૮.૦૦થી ૧૫.૦૦વાગ્યાસુધી બંધ રહેશે.

54 તં.	તારીખ	એસ.એસ.નું નામ	ફીડરનું નામ		
٩		મુન્દ્રા ઈન્ડસ્ટ્રીયલ	૧૧ કેવી જવાન જેજીવાય		
5	30-92-2023	એસ.એસ.	૧૧ કેવી ધ્રબ એજી		
3		મુન્દ્રા એસ.એસ.	૧૧ કેવી બોરાણા એજા		

ાલુ કરી દેવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી કાર્યપાલક ઈજનેરશ્રી, પી.જી.વી.સી.એલ. માંડવી ડીઓ



🤺 (એમ.ડી.)એ પાનધો વીજમથકની મુલાકાત લીધી ત્યારની તસવીર, ઇન્સેટમાં પાનધો ગ્રામજનો પણ પત્ર દ્વારા રજૂઆત કરી રહ્યા છે. **(તસવીર : વિશ્વનાથ** જોશી. ગિરીશ એલ. જોશી)

પાનધ્રો વીજ મથકના બંધ એકમો કાર્યરત કરવા અગ્રણીઓની રજૂઆત

દયાપર (તા. લખપત), તા. ૨૯ : પાનધો વીજ મથકના વડા આજે પાનધો ખાતે નિરીક્ષણ અર્થ આવતાં તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ તાલુકા પંચાયત હારા પાનધો વીજ મથકના બંધ એકમો કાર્યરત કરવા માંગ કરાઇ હતી

હતા. જી.એસ.ઇ.સી.એલ. (જી.ઇ.બી.)ના વહીવટી નિયામક (જી.ઝ.પા.)ના વહાયટા ાનવામક મોમેશ બંદોપાધ્યાયને જિલ્લા પંચાયત સદસ્ય મીનાબા દેશુભા જાડેજાએ રજૂઆત કરતાં કહ્યું હતું કે, વીજ મથકના એક્ય-૧ અને એક્ય-૨ બંધ કરી દેવાયા છે, એક્ય નં. ૪માં પણ ખામી સર્જાતાં છ

ડ્રાઈવરો સામે સજાની જોગવાઈના

સામખિયાળી ખાતે વિરોધ પ્રદર્શન

ભચાઉ, તા. ૨૯ : કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતના કેસમા માલવાહક વાહનના ચાલકો સામે

કરવામાં આવેલી સજાની જોગવ-

વિરોધમાં આજે

મહિનાથી બંધ છે અને તેને મરંમત નાહનાવા ખવ છે એને તેને નરનેત કરી ચલાવવાના બદલે કાયમી બંધ કરવાની પેરવી ચાલુ છે. પાનધો વીજ મથકના એકમો એક પછી એક વાંજ મવકના અકમાં અંક પછા અક બંધ કરી સોલાર પ્લાન્ટની યોજના ચાલુ થઇ રહી છે, પરંતુ સોલાર પ્રોજેક્ટમાં તાલુકા બેરોજગારોને રોજગારી મળતી નથી.

પાનધો વીજ મથકમાં હાલમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કામ કરી રહ્યા છે. પાનધ્રો લિગ્નાઇટ કરા રહ્યા છે. પાનમ્રા (લગ્નાઇટ ખાકાનું એક્સ્ટ્રેશન થવાનું છે તેણે ખાકાનું જે લિગ્નાઇટનો જથ્થો ઉપલબ્ધ છે માટે તમામ એકમો (યુનિટ) કાર્યરત રાખવા અનુરોધ કરાયો છે.

વીજ મથકના વહીવટી નિયામક (એમ.ડી.)એ પાનધ્રોમાં નિરીક્ષણ કર્યું

બીજીબાજુ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જશુભા જાડેજા પણ એમ.ડી.ને મળ્યા હતા અને વીજ મથકના ચારેય એકમ ચાલુ રાખવા માગણી કરી હતી સ્થાનિક રોજગારી માટે પાનધ્રો વીજ મથકના એકમો કાર્યરત રહે તેમજ વીજ ઉત્પાદનમાં આ એકમો બંધ ન કરાય તેવી માંગ

કરાઇ હતી. તા.પં. દંડક દિનેશભાઇ સતવારા, કુલદીપસિંહ ચાવડા, હાજી ઇશાક રાયમા, બાબુભાઇ પ્રજાપતિએ વીજ મથકમાં રોજગારી મળે તેવી રજૂઆત કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા કચ્છની મુલાકાતે આવ્યા હોવાથી શુક્રવારે તેઓએ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીનાં દર્શન કર્યા ત્યારની તસવીરમાં સાથે શ્રવણસિંહ વાઘેલા જોવા મળે છે.



** કરજ જિલ્લા તાલુકા નશાળંધી અમલીકરણ સમિતિમાં િળન સરકારી સભ્યાંની નિમલુક કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ તરીકે નશાળંધી અને આળકારી અધિક્ષક કચ્છ-ભુજ, સભ્ય મધિવ નશાળંધી નાયળ નિરીક્ષક ભુજ, સભ્ય પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મુંદરા પાલીસ સ્ટેશન તથા ઓક્સિર કમાનિંગ, ગૃહરક્ષક દળ પુરરા, મહિલા સન્ય પ્રેલીબેન જોશી, રચાતિબેન સિંપ, ભારતીબેન સાવલા, રચાભાઇ આઢીર, પાલુભાઇ બી ગઢવી, દિગંત બકુ, અલ્યેશ દરજની નિમલુંક કરવામાં આવી હતી. ઉપારેકન દૃશ્યમાં સમિતિના સભ્યો નજેર પડે હં (તક્ક્રી) - વિનોદ પ્રતેનો હ છે. (તસવીર : વિનોદ મહેતા)

PGMCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGMCL

મનકરામાં અડધા લાખનો નીકળી પડ્યો હતો. ગામના શરાબ ક્યાંથી આવ્યો, કોશ **શરાબ હસ્તગત** સચિન ખેંગાર કોળી અને આપી ગયો હતો ? તે સહિતની ભચાઉના સંધાઉ સીમમાં મહેબૂબ સિધિક હિંગોરાની વિગતો બહાર આવી નહોતી. ગાંધીધામના વકીલને રૂા. ૧૪૮નો દંડ વ્યાજ સહિત પરત કરવા આદેશ

ગાંધીધામ, તા. ૨૯ : અહીંના આદિપુરના ગાધીધામ, તા. ૨૯: અહીના આદિધુના પારાશાઓ પ્રીમિયમ ભરવા માટે રજૂ કરેલા ચેકમાં અક્ષરમાં તકાવત હોવાનું જણાવી પરત મોકલી દેવાયો હતો અને વક્ષિય પાસેથી રૂપિયા ૧૪૮ દંડ વસુ કરાયો હતો. આ એગે ગ્રાહક સુરક્ષા તકરારે નિવારણ કોરમ હારા સેવાની ખામી બદલ એલ.આઈ.સી.ને દંબની દેખ દ ત્યા વ્યાજ સાથે પરત કરવા આદેશ કર્યો હતો. આ બનાવની વિગત એવી છે કે, ફરિયાદી હોય છે. એ! અપ્રીમાં એની જાઈની જા

નરેન્દ્ર જે. તોલાનીએ એલ.આઈ.સી.ની જીવન આનંદ પોલીસી વર્ષ ૨૦૦૩માં લીધી હતી. જેના પ્રીમીયમની રકમ રૂ.૫૪૨૨ ગાંધીધામ કો.

ઓપરીટવ બેન્કના ચેક મારફતે એલ.આઈ.સી.માં વર્ષ ૨.૧.૨૧ના જમા કરાવી હતી. આ ચેક એલ.આઈ.સી. દ્વારા એક્સિસ

ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ફોરમે સેવાની ખામી બદલ એલ .આઈ .સી .ને લપડાક ફટકારી

બેંકમાં ક્લિયરિંગ માટે મોકલ્યો હતો. આ ચેક

દ્વારા લાઇફ ઈસ્યોરન્સ કંપનીને ઇ મેલ કરી દ્વારા લાઇક ઇમ્પારન્સ કરમીના ઇ મલ કરો દરિયાદ કરી હતી, પરંતુ કોઇ દાર આપઈ ન હતી અને ચેક પરતની રૂ.૧૪૮ પેનલ્ટી કરિયાદી પાસેથી વસુલ કરી હતી. કરિયાદીએ કાનુની નોટીસ આપી આહક સુરક્ષા લેગ્યાં કરીયાદ દાખલ કરી હતી. જેમ ચાહક સુરક્ષા તકરાર નિવારણ શેરમ હારા કરિયાદ મંચુર કરી સેવામાં આમી દેખાત એલ આઈ.સી. ચૂ. ૧૦૦૦ વળતર તરીકે અને રૂ.૧૪૮ વસુલ કરેલા દંડ હ ત્રિકારિંગમાં ન મોકલી એલ ઓઈ.સીને અસર ટકા વ્યાજ સહિત પરંત કરવા હુંકમ કર્યો હતો. અને શબ્દમાં તકાવતના શેરા સાથે પરત આ કેસમાં કરિયાદી પક્ષે વકીલ લલિતભાઈ કેલા મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ કરિયાદી અને કે. ડી.પ્રસાદ હાજર રહ્યા હતા.

દબાણ કરવાની હોડ જામી ભચાઉ, તા. ૨૯ : છેલ્લા કેટલાક સમયથી અહીં સરકારી જમીન પર પાકું ભાંધકામ કરી દુકાનો બનાવવાની હોડજામી છે. ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળનું અસ્તિત્વ ન હોય તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી

રહી છે ભચાઉ જૂના બસ સ્ટેશન બહાર એકસામટી આર.સી.સી. ક્રેમ સ્ટ્રકચરવાળી દુકાનો બેરોક્ટોક બનવા જઇ રહી છે. આ દબાણો તાત્કાલિક દૂર કરવાની

દબાણકારો સામે કડકાઇભર્યા પગલાં ભરવાની માંગ

માગણી મોહનભાઇ હરિભાઇએ

છ. પાકા બાંધકામની મંજૂરી

મેળવ્યા વિના બેરોક્ટોક જમીન પર કબજો કરનાર વ્યક્તિઓ પર લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ દાખલ કરી દબાણને ખાલી કરાવવાની માંગ ઊઠી છે.



🍇 દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવતા અગ્રણીઓ તથા ઇન્સેટમાં ધર્મજ્ઞાન પીરસતા સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી નજરે પડે છે. (તસવીર : શાંતિલાલ લીંબાણી)

ત્યાગ, સાધના અને સમર્પણ સનાતન ધર્મની ઓળખ

સંસ્કારધામ-દેશલપર (વાંઢાય), તા. ૨૯ : ત્યાગ, સાધના અને સમર્પણ સનાતન સાથના અને સમયણ સનાતન ધર્મની ઓળખ છે, તેવું લક્ષ્મીનારાયણ મંદિર કેન્દ્ર સ્થાન ખાતે પૂનમના આયોજિત સત્સંગમાં જણાવાયું હતું. લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન ખાતે સંતસભામાં સ્થામી પ્રદીખાનંદ સસ્સ્થતીનું ધર્મયોગ પ્રદાખાનંદ સસ્સ્થતીનું ધર્મયોગ પ્રવાચન યોજાં હતું પરિધાના

પ્રવચન યોજાયું હતું. પૂર્ણિમાના દિવસે હજારો ભાવિકો કેન્દ્ર સ્થાને ઉમટ્યા હતા અને સંતોર્ન દિવ્યવાણીનો લાભ લીધો હતો.

સંતોએ જ્ઞાન પીરસતાં જણાવ્યું કે, સુખ કે દુઃખ મનુષ્યના કર્મને આધીન છે. દયા, કરણા, સમર્પણ અને સાધના ભગવાન સાથે જોડાવવાના માર્ગો છે. આ પ્રસંગે સંસ્થાના

કોષાધ્યક્ષ કોયાું ખક્ષ ક્યાણજીભાઇ છાભેયા, બાબુલાઇ ચોપડા, બાબુલાઇ લેવાણી, ધીરજભાઇ ભગત, બેચરભાઇ ઠાકરાણી, દિલીપભાઇ ભગત, મગનભાઇ ચોપડા, ભજન તેમજ આરતી અને ચાલીસાનું પઠન દેશલપરની બેલડી રાજુભાઇ રામાણી અને કલ્યાણજીભાઇ

તરલાબેન રામાણીએ ભજનની સરવાણી વહાવી હતી. સવારે સંતોના હસ્તે દીપ

લક્ષ્મીનારાયણ મંદિર કેન્દ્ર સ્થાન ખાતે પુનમના સત્સંગ સભામાં સંતોની ભાવિકોને શીખ

પ્રાગટ્ય કરી સત્સંગ સભાને ખુલ્લી મુકાઇ હતી. સંતોએ જશાવ્યું કે, જે પરમુષ્યાળુ પરમાતાઓ નેખુ ઇઠ આપ્યો છે તે જીવનની જરૂરિયાતો કર્મ મુજબ આપશે. વિશ્વાસ અને શ્રદ્ધા જીવનની નાવ પાર ઉતારસે. આજુબાજુના ગામોથી આવેલ ભાવિકો માટે મહાપ્રસાદનું આપોજન કરાયું હતું, તેવુ ધીરજભાઇએ જણાવ્યું છે.

આપની જાહેરાત આપવા સંપર્ક જાહેરખબર વિભાગ, કરછમિત્ર કાર્યાલ ઇન્દ્રાબાઇ પાર્ક પાસે, ભુજ. વોટ્સ એપ/મોબાઇલ નંબર CXEG 30 35 33

Welspun[®]Living **વેલસ્પન લિવિંગ લિમિટેડ**

DLII : (ભૂતપૂર્વ વેશસ્થન ઈન્ડિસ) તિમિટેડ) રહિંદ કહેશ : વેશસ્થન હિટી, ગામ વર્ષામેડી, તા. અંપાર, પિ ટેશિ : ૧૧૧ ૨૮૩૬ દૃદ્દ ૧૧૧, ટ્રેક્સ ના : ૧૧૧ સો. તેઓ રે વેલવ્યન હોંચા, દુધ માદ, સમા પિતા કહ્યાં ત (પશ્ચિમ), મુંબર્ચ, ભૂતમભુ-૧૦૫૧૩, ટેલિ. ૧૧ ૧૧૬ ૧૩

તો. કમને, સ્કર્સ, ૧૯/૩૯લ તે તે દર દિલ્લાને કરો હતે હતી કરો હતું કરે તે કહ્યું કરે તે કહ્યું કરે તે કહ્યું કરે તે કહ્યું કરે કહ્યું કરે તે કહ્યું કહ્યું કરે તે કહ્યું કરે તે કહ્યું કહ્યું કરે તે કહ્યું કહ્

ે. (...) પોઝલ બેલેક પશ્ચિમાં સરજ અને પારાર્થીના માટે ઇન્દર્મનાં લેઇ છે. ડિકેશ્ટરમીઓએ થી સુવિલ ગોડે, માલિક મે. એશ્લોડિક એન્ડ એસોલિયેટસ ઇન્દ્રેડમીંડા ઇન્દ્રાની કેટ્રેટને સુકૃદિનાદાત્ર રહેલે ડિક્કુલ એટલે છે. (...) પોઝલ બેલેટનું પરિવાજ સોમ્પાર, ૨૦ જન્યુજારી, ૧૦ ૪ના ગોજ ઇન્દ્રોની એક એટલે કેડ અને પ્રત્યાન સામેત્ર અને તેની ભલેડુમાં ઇન્દ્રાનીના દોપણ ડિકેટલ છે ઇન્દ્રને એક એટલે ફાંપ્ય ઇન્દ્રોના પ્રત્યાન તેને ઇન્દ્રોમાં ઇન્દ્રનાનાં દોપણ ડિકેટલ છે ઇન્દ્રને એક એટલે ફાંપ્ય ઇન્દ્રોમાં આફ્રેટના પાર્ટિક પ્રતિસ્તા ઉપરાંત ઉભેસ્થેલ સિલેટ અને નોસ્તાલ સ્ત્રીલ એશ્લોએન્ય ક્લોઇ ઇન્દ્રિસ ડિકિટેડ અને ઇન્દ્રની લી નોસાયા છે)

સહી/ શશિકાંત થોરાટ - કંપની સેકેટર FCS-6505





SZEI GEZI)

માગસર વદ-3/૪, તા.૩૦ ડિસેમ્બર, શનિવાર

તંત્રી સ્થાનેથી....🌂

વિક્રમ સારાભાઈના ચોગઠાનને **ક**દાપિ ભુલી ત્ર શકાય.!



વિક્રમ સારાભાઈ, માત્ર ૧ રૂપિયાના પગારે કામ કરનાર પૈજ્ઞાનિક હતા, : ભારતની પજ્ઞાાનક હતા, : ભારતના ચંદ્રચાનની સફળતા વિક્રમભાઈ અ એપીજી અબ્દુલ ક્લામ જેવાઓની દિર્દ્યદ્રષ્ટી અને દેશસેવાની વરસો પહેલાની ભાવનાને જ છે આભાર

આખરે કચ્છને નવા પ્રાથમિક શિક્ષણાધિકારી મળ્યા

માંડવીના ગુંદીયાળી શાળાના આચાર્યને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બઢતી

શિશણ અધિકારી તરીકે તથા માંડવી તાલુકાની ચુંદીયાળી સરકારી માધ્યમિક શાળાના આચાર્ય કમલેશભાઈ મોતીલાલ મોતાને મોરબી જિલ્લા શિશણ અધિકારી તરીકે નિમણુંક અપાઈ છે.

અંજીદ : તાલુકાના વરસામેડી વિસ્તારમાં આવેલ દિવ્યાન્ટ સોસાયદીમાં ઓરીની ઘટના બની હતી. જેમાં સોંગલેથા શખ્યન અંજાદ પોલીસે સોંતિયામ યોકડી મેડાન પાસેથી આપી લીધો હતો. આરોપી શાંતિયામન્ટ રહેતા કિપ્જાા ઉર્કે દિપુષ અરવિંદભાઈ વ્યાસ પાસેથી પીલ્યાપત, આંત્રીરય, કહલી, બુદ્દી, ગાયની મૂર્તિ,

વરસામેડીની હિલાનર મોસાયટીમાં યોરી કરનારો યુવક પકડાયો અંજર : તાલુકાના વરસાયેડી મોબાઈલ સતિતનો ૪,૧૮૦નો વિસ્તારમાં આવેલ કિયાનર મુક્કમાલ મળી આવેલો, જ્યારે સોસાયકીમાં ચોરીની ઘટના બની ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ હતી. જેમાં એડોબોલો શખને જ બજરાવી બાઈક સેમ્પ પકડ, અંજર પોલીસે શાનિયામ ચોડાડી દિસમીસ સહિતના ઓપ્સરો પણ કર્યા પાર્થી મોતા મોડાડી ાડલમાત્ર સાહતના આજરા પણ કબજે લેવાયા હોવાનું અજમાયસી ડીવાયએસપી પી.જે. રેણુકા, ઈન્ચાર્જ પીઆઈ જે.એમ. જાડેજા અને વુમન પીએસઆઈ આર.સી. રામાનુજ જણાવ્યું હતું.

કરાયું હતું. ઢીતિય સત્રના અધ્યક્ષ સ્થાન કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ રામજીભાઈ પીંડોરિયા રહ્યા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કાનજીભાઈ કુંવરજીભાઈ છેલ્લા પાનાનું ચાલુ ભૂબનું સસ્દાર પટેલ ગોવિદભાઈ અને ગોવિદભાઈ (એસ.વી. સી. ટી.) સહ પરિવાર, વેલજીભાઈ ઝીણાભાઈ ગોરસિયા, પુત્રો અને સહયરિવાર, અ.નિ. લાલજીભાઈ ભીમજીભાઈ સૌઘાઈ હસ્ત્ર કોતિલાલભાઈ લાલજીભાઈ સૈંઘાણી દુન કોતિલાલભાઈ કાર્યકાર્યા હતે

પાંચાન્ય રહ્યા હતા. પૂર્ણના પાંચાનના રહ્યા હતા. પૂર્ણના કર્યા કરાય હતા. પૂર્ણના કર્યા કરાય હતા. પાંચા કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર કરાયું હતું. દ્વીતિય સત્રમાં એક્ય પર્વ નિમિત્તે શ્રેષ્ઠીવર્ય દાતાઓનું સન્માન, ઋણસ્વીકાર, સમાજની ભગિની સંસ્થાઓનું સન્માન

CONTACT FOR BOOKING નમત્રાણમાં ભાકે વદ્યા 2BHK વેચાણથી આપવાના છે રેડી પઝેશન બાલાજી કોમ્પ્લેસમાં, સી.એન.જી. પંપતી સામે, તખત્રાણા-કોટડા (જ) ફાઇવે ઉપર કિડાણા-સોસાયટી

રક રૂમ, હોલ, કિચન, ઓફિસ કુલ કમ્પલેટ ગેસ્ટ કાઉમ ટાઇપ તથા ફર્સ્ટ તથા સેકન્ડ ફલોર શકે આપવાના છે તથા દુકાન નં. ૧, ૨, ૪ ગ્રાઉન ફલોરમાં વેચવાની છે. ત્રણ દુકાન વેચવાની છે.

ગાંધીધામ. CONTACT NO.: 99135 00725

ઃઃ જાહેર નોટીસ ઃઃ



सर्वे नं. 123, अपनानगर, श्र स्डूलनी पासे

આથી હું ભવનભાઇ ભોજાભાઇ કોચરા, રહે. કિંડાણા સોસાચટી, તા.ગાંધીધામ-કચ્છ વાળા આ જારેટ નોટીસથી જાહેર કરે છું કે, અમારા બદેન શ્રીમાતી શાંતાઈન કિંવાનભાઈ કોડ અને કિંવાનભાઈ કાર એ તે ક્લિયાનાઈ કોડ અને કિંવાનભાઈ કાર એ ક્લિયાનાઈ કોડાયા તા.ગાંધીધામ-કચ્છ વાળાએ અમોને તથા અમારા પરિવારને કોઇપણ જાણ કર્યા વનર પોતાની મરજૂથી તા.૧૩/૦૪/૨૦૨૩ ના રોજ

ભવનભાઈ ભોજાભાઈ કોચરા (અમારી સૂચના અને વિગતો ઉપરથી)

કચ્છી સંત પુ.હરિદાસજી મહારાજની કઠિન પદયાત્રાનો ૧૭૧મા દિવસમાં પ્રવેશ

કડવા પાટીદાર સમાજના યુવાનો - વડીલો પદયાત્રામાં જોડાયા

ભુજ : વિશ્વ કલ્યાણની પાવન ભાવના સાથે સદ્દગુરૂ ભગવાન ઓધવરામજી મહારાજ ભગવાન ઓધવરામજી મહારોજ અને ભગવાન વાલરામજી મહારાજની પ્રેરણાથી કચ્છી સંત પૂ.હરિદાસજી મહારાજે દરિદ્વારથી કચ્મા કુમારી સુધીની પદયાતા આદરી છે, ગત ૧૨મી જુલાઈએ હરિદ્વાર સ્થિત કચ્છી લાલ રામેશ્વર આશ્રમથી નિકળેલી પદયાત્રાએ આજે

નાગિયારી બસ સ્ટેશન પાસે એસટી બસને આંતરી ચાલક પર જીવલેણ હુમલો કરાયો

ભુજ : તાલુકોના નાગિયારી ગામના બસ સ્ટેશન પાસે એસટી બસને આંતરી ચાલક પર ગામમાં મને ભુનાના પાસે એક્ટરી બર્સમાં આવે તે આતરી ચાલક પર જ્વલેલ હુમલો કરાતા માનકુવા પાંલીસમાં વિવિધ કલ્લમાં તળે ગુનો દાખલ કરાયો છે. કરિયાદી લાંકીના શંકરળાઈ નારણભાઈ આદિસ ધુંદરા - નારાયલસરોવર કટની એક્ટરી અલ લઈને જતા હતા, ત્યારે બોલેરો નંબર જી. જે ૧૨ બી. આર. ૦૮૯૧મે ઓલેરી આલક અને તેની સાથે જાએ બજાણમાં માણસ અને નૃત્રમામક નામના શપ્ય સ્સાથાં બસને છેલી ગરાવી દરિયાદી નીચે ઉતારી કાયકેસરની કરજમાં કરાવટ કરી ઘબ્ધુંશરનો અને લોપંડના પાઈપ વડે માર આપી હતો. કરિયાદી બસમાં બેસીને રવાના શૂતા હતા, ત્યારે પણ હતા. કારયાદી બસમાં બસીને રવાના થતા હતા, ત્યારે પણ આરોપીઓએ તમે સારા માળલો નથી તેમ કહી કરી મારમાર્યો હતો. અને બસનો દરવાજો પોત્ર ડ્રાઈવર સાઈડનો પાછળ જોવાનો નાનો કાચ તોડી નાખ્યો હતો. જેથી માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી છે.



જન્મદિન મુબારક



તા.૩૦-૧૨-૨૦: ઇના શુભ જન્મ દિને ૫' પરિવાર તેમને ખૂ દય' પારવાર ત ાર્દિક શુભકામના ાતા : **અશ્વિનભા** ાતા : **નીતાબેન**

કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુ. કે.)નો ઋલ સ્વીકાર કરાય હતો. દતાઓ કાનજલાઈ હતો. દતાઓ કાનજલાઈ હતો. હતાઓ કાનજલાઈ હતાં હતાઓ કાનજલાઈ હતાં હતાં કાંગ્યાના કાંગ્યાના

સંપર્ક : હરેશભાઇ પટેલ M. 99780 55305

બાબુલાલ લઘુભાઈ મારૂ (સુવાર) વિરૂદ્ધ ૧૦સ-મરણ નોંઘણી અધિકારીશ્રી, અંજાર



૧૭૧માં દિવસમાં પ્રવેશ ચાલીસાના પાઠ સાથે પૂ. કર્યો છે. આજે વહેલી સવારે મહારાજથ્રી અને સાથે સેવક સદ્દગુરૂના પૂજન અને વાલરામ ગણે પદયાત્રા આગળ ધપાવી

હતી આજે વહેલી સવારન હતી. આજે વહેલી સવારના આહાલાદ, વાવારવામાં 10 કહતી, જેમાં યુ, અહાજકીની સાથે મોતીરબિંદુથી ગામના કડવા પાટીદાર સમાજના યુવાનો અને વહેલા સાથે જોડવા પાટીદાર સમાજના યુવાનો અને વહેલા સાથે જોડવા હતા. મોતીરબિંદુથી નિકળેલી પદસાગાએ રનીરિબિંદુ ગોનિકળેલી પોલાના ક્લોડિકના રનીરિબિંદુ ગોને પાસેક્ટર અને પાટીદાર સમાજના અગ્રસ્થીઓ પૂ, મહારાજકીની પ્રમાજના પટલ અને પાટાકાર સનાજના અગ્રણીઓ પૂ. મહારાજશ્રીના દર્શનાર્થે પહોચ્યા હતા અને પદયાત્રામાં સાથે જોડાયા હતા.

બેલાના ચાર ધાર્મિક સ્થાનોને અભડાવતા તસ્કરો

પાંધાગા પાંધ તા રાપર : તાલુકાન બેલા ગાંચ એક જ દિવસમાં ચાર અલગ અલગ યાર્મિક સ્થાનોમાંથી રુ હજીરતી તોરી થતાં સ્થાનિક લાગલી દુખાઇ હતી. રાતના સમયે આ બનાવ બન્યો હતો. જેમાં વિજેશન મહાદેવના મંદિરમાં તાળા તોડી પંચ પાતની ભગવાન શિવની મૃતિ, ર ચાંહીતા છતર, રસોનાના છત્તરની ચાંચી કરી હતી. તાયાંભાઇ પારેવરમાં આવેલા સોની પરિચારના સુરાયુગ લાયાજ દાદાના મંદિરમાંત્રી પણ પાંચ છત્તર સોરી જવાયા હતા. બાદમાં તપાલ કરતાં ગામમાં આવેલા સોની પરિચારના ચાંયુગ્ર માતાછના

એક સાથે ચાર દેવાલયોમાંથી દર હજારની ચોરી : પોલીસની નિષ્ક્રીય ભમિકા સામે લોકોએ સવાલ ઉઠાવ્યા

મંદિરમાંથી ચાંદીનું છત્તર, મુગટ, માતાજીનો ચાંદીનો હાર, ૩ પારશા, પિત્તળના ર શીહાસન તેમજ પ્રજાપતિ વારૈયા સમાજના ચામુંડા માતાજીના મંદિરમાંથી પણ ચાંદીનું નાગ અને

ર છત્તર ચેવી જવામાં આવ્યા હતા. આપના કુલ ચાર દેવાલયોમાંથી ૧૯ હજાર રેપિયાના મુક્કમાલની ચોરી થયાની કરિયાર પૂછી રોજપગન વાત્ર કરવાની કરિયાર કરિયા

મૃન્દ્રા સોપારીકાંડમાં સસ્પેન્ડેડ એએસઆઈ કિરીટસિંહ ૧૪ દિવસના રિમાન્ડ પર ગેરકાયદે ધંધાનું નેટવર્ક ચલાવતો

ચોરીની શંકાએ મુંબઈના બિલ્ડરનું અપહરણ કરી વાગડમાં લવાયો

મુંબઈ: એરોલીમાં બાંપકાપના વેપારી ખીમજ ચીપદીનું ચોરીના આદોપમાં અપહરક થયાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમને લાકડી વડે માર માર્યા હતો અને ચોરીના દાગીમાં અને ઘેશા પરત કરવાની માંગણી કરી હતી. આ મામલામાં છ હોકે સામે અભારક્ત અને માર્યાઓ કર્યો ખીલાયા અના છે, અખદત ચીપદીની માર્યા માર્યાદી હતો. જેમાં ચોરીની આક્રેશી ૧૫ ડિલ્માર્ચ એરોલી સેક્ટલ વર્માથી અપહારક દાયું હતું કેર માન્યા દીત્સોને વાર તાલુકમાં કન્પર ગામના મંદિરે લઈ ગયા અને ત્યાં દેવતાને મંદિરમાં લાવવાના પ્રયાસ કર્યો, અને પછી મુક્ત કરવામાં આવ્યા હોવા રાશે આ લું છે, આ પ્રકરાશાં કંતા, મેંજનાલ , કિરણ, જવસુખ, ક્લીશ અને વધુ એક લાક્તિ વિસ્તૃત અપકરલ અને માર્યાટનો કેલ નોંધવામાં આવ્યો છે.

મન્દ્રામાં હોટલ સંચાલકે मुसाइरोनी **એ**न्ट्री न કરતા ફરિયાદ

ભુજ : હોટલ-ગેસ્ટહાઉસના સંચાલકોએ મુસાફરોની ઓનલાઈન પથીક સોફ્ટવેરમાં ઓનલાઈન પક્ષીક સૌક્ટવેરમાં એન્ટ્રી કરવાની હોય છે તેમ છતાં મુન્દ્રમાં ઝીરો પોઈન્ટ પાસે આવેલી હોટલ સેન્ટર પેલેસના સંચાલકોએ હોટલમાં ટેકાતા મુસાકોની એન્દ્રી સૌક્ટવેરના લહેર વિજ્ટવેરના લહેરના અહેરનામાનો બંગ લાતા સંચાલક વિક્રમ તેજભાઈ વાલેલા સામે મુન્દ્ર પોલીસમાં જીહેરનામાં ભેગનો અસેઓજીએ નોયાલો હોય મુન્દ્ર પોલીસમાં જીહેરનામાં ભેગનો અસેઓજીએ નોયાલો હોય મેન્ડનો પોલીસમાં અસેન્ડોએએ એએએએએનોયાઓ હતી. જાહેરનામા ભેંગનો ગુનો એસઓજીએ નોંધાવ્યો હતો.

મનફરા પાસે ખાડો ખોદીને સંતાડેલો પદ્

ભારતો દારૂ પ્રપ્રાયો ભાવી : તાલુકાના મનદરા ભાવી : તાલુકાના મનદરા ભાવી સંઘોઇ ગામને જેઠતા રસ્તામાં પડતર જગ્યાએ ખાડો ખાદીને દારૂ છૂપવાવામાં આવ્યો હતો. ભાગોઇ પાંહીસ ભાગોની ૧૫૦ ભાગેદલ કિંમત ગાડી પાંહીસ ૧૫૦ ભાગેદલ કિંમત દ્વા. પદ, ૧૫૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે સાંતલસ્ત્રી વાડી વિસારા-ભાગા બંધો હાજર ન મળી આવતા બંધે વિસ્કૃત ભાગોઇ પાંહીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાદીમાં પોંચાઇ અને શક અંભવા ખેતા પીએસઆઈ કે બી.તરાર સહિતના જેડાયા હતા. હજારનો દારૂ ઝડપાયો

ઃ જાહેર નોદીસ ઃઃ નામદારશ્રી એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની ફોર્ટ સમક્ષ, અંજાર-કચ્છ.

લવી. મેજ તારીબ : ૨૯/૧૨/૨૦૨૩ નાં રોજ મારી સહિ તથા આ કોર્ટનું સીલ કરીને આપ્યું. ...

મુંબઈમાં એસયુવી કારમાં અચાનક આંગ, કચ્છી પરિવારનો આબાદ બચાવ



મુંમઈ : કંચારા ઘટ્યાં પાસિક તરફ જતી એક એમ્સફુવી સાર્ટ્સ તરફ જતી એક એમ્સફુવી સાર્ટ્સ હરમાં જો સમય છે. તાર્દ્ધ સાર્ટ્સ હરમાં કરમાં કર્યા હતા. તેમણે કારમાં એસાપાંથી ધુમાડો નીકળતો જોય બાદ કાર રસ્તાની એક બાજુએ લિવી રાખી દીધી અને તાત્કાલિક બપા બહાર નીકળી જતાં આબાદ ભાગા થયો હતો. તેઓ કારની બહાર નીકળ્યાની ગાસતાની સેકન્યાં આપાની આસતાની સેકન્યાં આપાની કર ભડળક બળવા લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ સવારના સમયે બ્લુ રંગની મહિન્દ એમહાવી પાટળ કાર (નંબર એમબેલ ૮૦ કાર (નંબર માં આગ લાગી હતી. કારમાં એ સમયે મુંબઈના એસેટીમાં રહેતા

પરેશ જપરામ પટેલ સહિત છ લોકો હતા. તેઓ આગ લાગ્યાની અધ્યું કહ્યું કે ક્યાર પહેલાં જ કરાં આ કર્યા કહ્યું કે ક્યાર પહેલાં જ કરાં કર્યા આ દરભામાં કે જા નહીતા કરી ત્યારે મુંબબીન વિર્કે પહેલાં ત્યારે મુંબબીન વિર્કે પહેલાં રહેતા કોટોગ્રાસ્ટ જિતન ગાંધી મિત્રો સાથે દેવલાલી તરક જઈ રહ્યા હતા. અનેક લોકોને સ્સ્તામાં ઉભાવા જઇને તેના પીતાની કાર ઊભી રાખી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે એપીયમાં સ્ટેશનપીની દુકાન પચાવતા કચ્છી પરેશ પટેલ તતાના પરિવાર ક્રારે નાઈક પાર્ટલ જતા હતા ત્યારે કારમાં આગ લાગી હતી. હાયર સિંગો આગ પર કાલુ મેળવ્યો હતો.

શ્રી સર્વોદય સ્પોર્ટસ સેન્ટર, માધાપર-ઈ-૬૬૦-ભુજ જાહેર નોટિસ

મહિર નોરિસ કરવાની કે: બી સર્વોદ્ય સ્પેડિસ તેમ્દર, માધાપ્ર-ઈ-૧૭૦-૧૫ કરવાની કે: બી સર્વોદ્ય સ્પેડિસ તેમ્દર, માધાપ્ર-ઈ-૧૭૦-૧૫ દ્રસ્ત્રના સુચ્વાસ્થિત સંચાલના અને વહીવર મોટે ગોગના (કર્યો મ કરવાનું) જરૂરી લાગતા આ કાર્યાલાં ફિસ્સ મોટે ગોગના (કર્યો મ કારોબાદી સનિતિની નિર્દિઝ તા. ૦૫.૧૧.૨૦૧ના રોજ તેમ્જ તા. ૦૨.૧૦.૨૦૨લા રોજ મળેલ વાર્ષિક સામાન્ય સભામાં સર્વસંમતિથી પસાર કરેલ અને તેના અનુસંઘાને રાજકોટના મહે. સંસ્કૃત રાજિ અને કરેલ અને તેના અનુસંઘાને રાજકોટના મહે. સંસ્કૃત રાજિ (અ) તે તે સ્વીમ અસ્ટ જુ રાખેલ છે. જે તે સ્વીક્ર સ્વીક્ર સ્વીક્ર સ્વીક્ર સ્વાર્થ સ્વીક્ર મારે સ્વાર્થ સ્વીક્ર સ્વાર્થ સ્વીક્ર સ્વાર્થ સ્વીક્ર સ્વાર્થ સ્વીક્ર સ્વાર્થ સ્વાર્થ સ્વીક્ર સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્ય સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્થ સ્વાર્થ સ્વાર્ય સ્વાર્ય સ્વાર્ય સ્વ

(ટ્રસ્ટીની સહી) શ્રી સર્વોદય સ્પોર્ટસ સેન્ટર સ્થળ : ભુજ તારીખ : ૨૮-૧૨-૨૦૨૩ มเยเนร-ย-รรง-ตุช

વવારના માથાભારે શખ્સને ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો



મુન્દ્રા : તાલુકા વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરી જાહેર પ્રજાની શાંતિમાં ખલેલ પહોંચાડી ભયજનક વ્યક્તિ તરીકે છાપ કચ્છ, બનાસકાંઠા, મોરબી અને પાટણ જિલ્લામાંથી એક વર્ષ માટે

તડીપાર કરવામાં આવ્યો છે. બાબુ ગઢવી સામે મુન્દ્રા મરીન અને પ્રાગપર પોલીસમાં દારૂ અને મારામારી સહિતના આઠં ગુનાઓ નોંધલેલા છે. તપીયા-શુનાર વ્યક્તિ મુન્દ્રા પંઘકમાં દેશીદડાનું વેલાઇ કરતો હતો. આરોપી વિરૂદ્ધ ગામમાં છરી જેવા તિશ્લ હથિયા ખુલા રાખી લોકોમાં તપ કેલાવવાની કરિયાદ નોંધાયેલી છે. આ વિલાય ગામમાં લોકોમે દાદુ પીને આળાગાળા કરવાની, ચાલતા લોકોમે નિયા વાદે ખલ્લા વહે મારવાની તથા લોકોન ઘર્ય પૂસી હંગામાં કેલાવી કરિયાલે અને મારામારી સહિતના ધૂસી હંગામો કરવાની ફરિયાદો નોંધાયેલી છે.



કરાગના પ્રચારે આવેલા રાજસના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ લાવેલાએ ભૂગમાં પૂર્વ રાજ્યમંત્રી અભાવત્વાલાંકી રહ્ય. તારાચંદભાઈ છેકાના પહિરાર સાથે યુવાકાત કરી હતી. તેમારો રહ્ય. તારાચંદભાઈ છેકા અને રહ્ય. 'પરેશભાઈ છેકા સાથેના સેશ્કરાની સાથ કર્યો હતા. આ લેલાઓ હૈસાલોના છેકા, છુગરભાઈ છેકા અને પરિવારયનોએ યૂર્વ મુખ્યમંત્રીને આવાકાર આપી. હોં

૧૫ વર્ષ પહેલા ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયેલા નુંધાતડના તલાટીને સજા

ભુજ : અબડાસા તાલુકાના નુંધાતડ ગામનો તલાટી ૧૫ વર્ષ પહેલાં ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયો હતો. જેને એક વર્ષની ઝડપાયા હતા. જેમ એક વેષમાં સજા ફટકારવામાં આવી છે. આરોપી મૂળ દાહોદના અને તે સમયે નુંધાત્ડ તલાટી

તરીકે ફરજ બજાવતા કેશવભાઈ તરીકે કરજ બજાવતા કેશવભાઈ મગનભાઈ ડામોરે મીંધાણી ગામમાં આવેલ જમીનમાંથી બેન્ટોનાઈટ ખનીજ કાઢવા માટે કરિયાદીને જમીનના ૭/૧૨, ૮-અ તથા હકક પઝવને નોંધો તેમજ કી પ્લાન નકશા કાઢી આપવા માટે લાંચ માંગી

ભુજ એસીબી કોર્ટે એક વર્ષની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો તા.૨૩/૧૨/૨૦૦૮ ના લાંચની ૨કમ સ્વીકારી હતી. તેની વિરૂધ્ધ

તપાસ અધિકારી ભવતુભા આર ઝાલા, વી.વી.ગોહિલ દ્વારા સર્વગ્રાહી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ કરાઈ હતી. સરકારી એચ.બી.જાડેજાએ વકીલ પકાલ અંચ.ખા.જાડજાએ ધારદાર રજુઆતો કરતા નામદાર જજ શીલ્પાબેન એમ. કાનાબારે આરોપીને તક્સીરવાન જાહેર કરી એક વર્ષની સખત કેદની 388 અપના નાટ લાય નાગા - ગામમાં માં દિવાસના પ્રકર્ણની. તા. ૧૮/૧૨/૨૦૦૮ કરી એક વર્ષની સખત કેલી ના રૂા.૨૫,૦૦૦/- ની માંગણી સજા તથા રૂા. ૧૦,૦૦૦/-કરી છેવટે રૂા.૨૦,૦૦૦/- દંડ ભરપાઈ કરવાનો હુકમ નક્કી થયા હતા. આરોપીએ કર્યો હતો.

Welspun LIVING นิตะนด ตินี่วา ติหิวิธ

Welspuri Lunno વેલસ્પાન હિલિંગ હિલિંગ હિલિંગ સ્વિક્રિટેડ (ભૂલુલે વેલમ્લ લિંગ હિલિંગ હિલિંગ ક્લિંગ કલ્લા કલિંગ કલિંગ

(જ) I-vacturis જાણવાદ તથાવા માન્યક્રત અંદર શાહિત કરવાથા પારંભી જાણ www.welspuniiving.com/uploads/investor_data/investoreport_8 7471.pdf dai એનએસકીએલ https://www.evoting.nsdi.com/ લેવન બીએસાં વિસિર્ટેંડ http://seindia.com/ ઉપારં ત્રેવાલ રહેશ એકરોજે એક ઇન્દ્રિયા ત્રિસિર્ટેંડ https://www.nseindia.com/ ઉપાર પ્રકાશિત કરવામાં આવેલ કે

(2) પોસ્ટલ બેલ્ટ પ્રશિયાને સાથ અને પાદરક્રિતા માટે કંપાનીમાં બીકે ઓફ ક્લિક્ટરમીઓએ થી વૃત્તિ કંદી, માહિક કે, એકપોર્ટેક એક્ક એમીસેસ્ટર, એક્ટર્સિક કંપાની કેન્દ્ર કેન્સ કેન્દ્ર કેન્દ્ર કેન્દ્ર કેન્ટ્ર કેન્ટ્ર કેન્સ કેન્દ્ર કેન્દ્ર કેન્દ્ર કેન્દ્ર કેન્દ્ર કેન્સ કેન્દ્ર કેન્દ્ર કેન્દ્ર કેન્દ્ર કેન્સ કેન્ટ્ર કેન્ટ્ર કેન્દ્ર કેન્સ કેન્

બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં ફૂકમથી सही/ शशिकांत थोराट - कंपनी सेक्टर FCS-650